



Ports and
Logistics

Ref No: APSEZL/SECT/2021-22/35

June 16, 2021

BSE Limited

Floor 25, P J Towers,
Dalal Street,
Mumbai – 400 001

Scrip Code: 532921

National Stock Exchange of India Limited

Exchange Plaza,
Bandra Kurla Complex,
Bandra (E), Mumbai – 400 051

Scrip Code: ADANI PORTS

Sub: Newspaper Advertisement – Intimation of Record date for final dividend

Dear Sir,

Pursuant to Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith copies of newspaper advertisements published in The Indian Express (English) and Financial Express (Gujarati) on 16th June, 2021, intimating about record date for final dividend.

Kindly take the same on your record.

Thanking you,

Yours faithfully

For Adani Ports and Special Economic Zone Limited

Kamlesh Bhagia
Company Secretary



Adani Ports and Special Economic Zone Ltd
Adani Corporate House, Shantigram,
Nr. Vaishno Devi Circle, S. G. Highway,
Khodiyar, Ahmedabad - 382421
Gujarat, India
CIN: L63090GJ1998PLC034182

Tel +91 79 2656 5555
Fax +91 79 2555 5500
info@adani.com
www.adaniports.com

indianexpress.com

The Indian Express
— JOURNALISM OF COURAGE —

I arrive at a conclusion not an assumption.

Inform your opinion detailed analysis.

The Indian Express.
For the Indian Intelligent.

NOTICE

Notice is hereby given that the following share certificates 15425, starting distinction no. 2420301, and distinction 2420300 - shares 100 - for HLE GLASSCOAT LIMITED, and share certificates 15426, starting distinction number 2420301, and distinction no. 2420300 - shares 100 - for HLE GLASSCOAT LIMITED are registered in our name - Sunita Lakhera and Roman Lakhera have been issued.

Therefore we have applied for issue of duplicate share certificates to: HLE GLASSCOAT LTD, whose registered office is at: H - 106, Phase - IV, G.I.D.C. Estate, Vithal Udyognagar, Anand Dist., Gujarat, India.

So, general public are hereby warned not to deal with the following securities and if the company does not receive any objection within 15 days from the date of publication of this notice on the above mentioned registered address of the company's RA* agent, Lakshmi India Pvt. Ltd., B102/103, SHANGHILA COMPLEX, FIRST FLOOR, OPP. HDFC BANK, NEAR HACHAKRISHNA CHAR RASTA, AKOTA, VADODARA - 390020. The company will proceed for issue of duplicate share certificate in our names.

Sr	Folio No	Name of Shareholder	Distinctive No	Cert Nos	Shares
1	00003923	SUNITA LAKHERA	2420301-2420300	15425	100
2	00003922	ROMAN LAKHERA	2420301-2420300	15426	100

Classifieds

PERSONAL

CHANGE OF NAME
I have Changed my Name Old Name **Pankaj Kumar Shankarlal Tank to New Name Pankajbhai Shankarlal Prajapati**
Address : F/10, Shantinath APARTMENT, Vejalpur, Ahmedabad : 380051

CHANGE OF NAME
I Smt. Bhoti legally mother of Army no. JC-339776H, Rank Subedar Major Hony Lt. Laxman Singh Presently Residing at : Village-Sangail, PO-Ujina, Teh-Nuh, Dist-Nuh, State Haryana -122107 have change my name from Smt. Bhoti to Vohti & My right Date of Birth is 1-1-1931 instead of 1-7-1922.

CHANGE IN NAME
I have changed my name from **Gavria Gurpreetkaur Satnamsingh to Gavria Gurpreetkaur**
Address :- B-28, Vadodara Central Government Society, New Sama Road, Vadodara, Gujarat, India.
for all purpose

CHANGE IN NAME
I Have Changed my Name from **Manpreetkaur Satnamsingh Gavria to new name Gavria Neelam**
Address :- B-28, Vadodara Central Government Society, New Sama Road, Vadodara, Gujarat, India.
for all purpose

"IMPORTANT"
Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.

PASCHIM GUJARAT VIJ COMPANY LIMITED
Corp. Office, Nanamava Main Road, Laxminagar, Rajkot-360004

www.pgvcil.com http://guj_epd.gov.in

Tender Notice No. 75
Turnkey Tender for Supply, laying and commissioning of 11 KV Single Core Copper XLPE Submarine cables (2 X 150 Sq mm) in HDPE Pipe with due protection on sea bed by replacing 02 Nos. of deteriorated marine cable between Okha and Beyt-Dwarka Dist.: Dev-Bhoomi Dwarka on Turkey basis with 5 years repairs & maintenance is put up on our ONLINE (e-Tender) website <https://pgvcl.nprocure.com>. Interested bidders are requested to submit the tender online. Tender documents for view and download are also available on our website [www.pgvcil.com](https://pgvcl.com). Interested bidders may download the same from this website. In future, if any amendments will be required for this tender, same will be uploaded only on above websites.

"Install ELCB and Protect life from electric shock"
Chief Engineer (Project)
"Customer Care Center Toll Free No. 1800 233 155333 & 19122"

DISTRICT WATER & SANITATION UNIT - KHEDA
TENDER NOTICE NO. 06 OF 2021-22
Tender ID. No. 455494, 465501, 465505, 465513, 465721, 465726, 465992, 465998, 466002, 465813, 466494, 466515, 466487, 466498

Unit Manager District Water and Sanitation Unit WASMO, KHEDA Gujarat State Invites online tenders on behalf of Different Village Pani Samittees for below motioned work.

1 Name of Work: Total No. of 14 works in different villages of in Village Water Supply Scheme.
2 Total Estimated Cost :- From Rs. 6.40 Lac to Rs. 39.92 Lac.
3 Last Date of Submission of Tender :- Dt. 05.07.2021 up to 18:00 Hrs
4. Last Date of Submission of Physical Documents of Tender :- up to 06.07.2021 15:00 Hrs.

Further information is available at website <https://www.nprocure.com> Control Room is functioning at the State Level for rural level water supply schemes where toll free No 1916 can be contacted for water related complaints / suggestions.
INFO/NAD/155/2021-22

adani Adani Total Gas Limited
Gas (Formerly known as Adani Gas Limited)

NOTICE OF RECORD DATE FOR FINAL DIVIDEND

Notice is hereby given that the Company has fixed Friday, June 25, 2021 as the Record Date for the purpose of payment of Final Dividend of Re. 0.25 per share (as recommended by the Board of Directors) for the financial year 2020-21, if approved by the Shareholders at the ensuing Annual General Meeting of the Company.

The Shareholders whose name appear in Register of Members / Beneficial Owners as on Record Date i.e. Friday, June 25, 2021 shall be entitled to receive Final Dividend, if approved by the Shareholders.

For Adani Total Gas Limited
Place: Ahmedabad **Gunjan Taunk**
Date: 15.06.2021 Company Secretary

Registered Office: "Adani Corporate House", Shantigram, Near Vaishno Devi Circle, S. G. Highway, Khodiyar, Ahmedabad - 382421, Gujarat (India)
Phone No.: +91-79-26565555 | **Fax No.:** +91-79-25555500
Website: www.adanigas.com | **CIN:** L40100GJ2005PLC046553

SUN FINLEASE (GUJARAT) LIMITED
(CIN: L65910GJ1988PLC01293)
3, Ravipushp Apartment, B/s. Navneet House, Memnagar, Ahmedabad - 380052
Email Id: sfgl1988@gmail.com Website: www.sfgl.in.net
Telephone No. (079) 27496313

EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR QUARTER AND YEAR ENDED ON MARCH 2021
(Rs. In Lacs)
(Except For Earning Per Share)

Particulars	Quarter ended	Year ended	Corresponding Quarter ended in previous year	Previous Year ended
	31-03-2021 (Audited)	31-03-2021 (Audited)	31-03-2020 (Audited)	31-03-2020 (Audited)
Total Income from Operations (net)	(77.75)	228.62	163.23	598.94
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(103.60)	22.63	(302.48)	4.23
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(103.60)	(0.10)	(302.48)	4.23
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(131.02)	(27.52)	(302.48)	3.57
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax))	(131.02)	(27.52)	(302.48)	3.57
Equity share capital	303.34	303.34	303.34	303.34
Earning Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations)				
Basic:	(4.32)	(0.91)	(9.97)	0.12
Diluted:	(4.32)	(0.91)	(9.97)	0.12

Note :
The Above is an extract of the detailed format of Quarter and year ended on March 31 Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and other Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarter and year ended Financial Results are available on the websites of the Stock Exchange and the listed entity (www.sfgl.in.net and www.mse.in).

FOR SUN FINLEASE (GUJARAT) LIMITED
SD/-
PARAG P. SHAH
(MANAGING DIRECTOR)
DIN: 00228965

Place : Ahmedabad
Date : 15 June, 2021

Madhusudan Industries Ltd.
Regd. Office: Survey No. 359/B, 359/C, 361 & 362, Rakhial-382315 Tal. Dehgam, Dist. Gandhinagar, Gujarat
Ph: (02716) 267270 Email: madhusudan_i@yahoo.in Website: www.madhusudan-india.com CIN: L29199GJ1945PLC000443

EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31st MARCH, 2021
(₹ In Lakhs)

Sr. No.	Particulars	Quarter Ended		Year Ended	
		31.03.2021 (Audited)	31.03.2020 (Audited)	31.03.2021 (Audited)	31.03.2020 (Audited)
1	Total Income from Operations	24.93	25.93	91.31	102.87
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	123.19	(123.50)	478.52	(136.02)
3	Net Profit/(Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	123.19	(123.50)	478.52	(136.02)
4	Net Profit/(Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	95.91	(96.30)	358.33	(97.55)
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	97.74	(95.96)	359.23	(98.80)
6	Equity Share Capital (Face value of Rs.5/- each)	268.75	268.75	268.75	268.75
7	Other Equity (Reserves excluding revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	1,841.74	1,482.51
8	Earnings per equity share (of Rs.5/- each) (Not annualised):				
	(1) Basic (Rs.)	1.78	(1.79)	6.67	(1.81)
	(2) Diluted (Rs.)	1.78	(1.79)	6.67	(1.81)

Notes:
(1) The above is an Extract of the detailed format of results for quarter and year ended on 31st March, 2021 filed with the Stock Exchange under Regulation - 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly/yearly results are available on the website of the Stock Exchange (www.bseindia.com) and the Company's website (www.madhusudan-india.com).
(2) Figures of the previous periods have been regrouped/ reclassified wherever consider necessary to conform to the current period presentation.
(3) The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meetings held on 15.06.2021.

Date : 15.06.2021
Place : Ahmedabad

By Order of the Board of Directors
For, Madhusudan Industries Limited
Rajesh B. Shah
Director
DIN: 00607602

adani Adani Ports and Special Economic Zone Ltd.
Ports and Logistics

NOTICE OF RECORD DATE FOR FINAL DIVIDEND

Notice is hereby given that the Company has fixed Friday, June 25, 2021 as the Record Date for the purpose of payment of Final Dividend of Rs. 5 per share (as recommended by the Board of Directors) for the financial year 2020-21, if approved by the Shareholders at the ensuing Annual General Meeting of the Company.

The Shareholders whose name appear in Register of Members / Beneficial Owners as on Record Date i.e. Friday, June 25, 2021 shall be entitled to receive Final Dividend, if approved by the Shareholders.

For Adani Ports and Special Economic Zone Limited
Place: Ahmedabad **Kamlesh Bhagia**
Date: 15.06.2021 Company Secretary

Regd. Office: "Adani Corporate House", Shantigram, Near Vaishno Devi Circle, S. G. Highway, Khodiyar, Ahmedabad - 382421, Gujarat, India
Phone No.: +91-79-26565555 | **Fax No.:** +91-79-25555500
Website: www.adaniports.com | **CIN:** L63090GJ1998PLC034182

Capital Region Urban Transport
Block-1, 2nd Floor, BMC Bhawani Mall, Sahred Nagar Bhubaneswar, Odisha (INDIA), Pin - 751007, E-mail: crutbbsr@gmail.com, Phone No. 0674 2548625

Notice No. 761/CRUT/2021 Tender Notice Date: 04/06/2021

RFP for selection of Integrated Transport Management System (ITMS) partner For Supply, Installation, Commissioning & Integration along with 5 years of Operation & Maintenance of ITMS for public transport services managed by CRUT, Odisha.
CRUT invites proposal from interested bidders for the above-mentioned purpose. Please refer Tender document for details.

The Tender Document shall be available from 16/06/2021 onwards in the Website: www.capitalregiontransport.in. Further intimation i.e. (Corrigendum / Addendum / Clarifications) shall be uploaded in the above website only.

Applicants are required to submit the duly filled proposals as per the prescribed format on or before 28/07/2021, 3.00 PM. The proposals received shall be opened on 29/07/2021 at 11.00 AM.

Incase of any query/clarifications, please contact 0674-2548625 or send email at crutbbsr@gmail.com.

CRUT reserves the right to accept or reject the bid process without assigning any reasons thereof.

Sd/-
Managing Director
Capital Region Urban Transport

Vikram THERMO (INDIA) LTD
Regd. Office : A/704-714, THE CAPITAL, Science City Road, Ahmedabad-380060, Gujarat, India
Phone: +91-79-48481010/11/12 E-mail: exports@vikramthermo.com
Website: www.vikramthermo.com

EXTRACT FROM THE STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31-03-2021
(Rs.in Lakhs)

Sr no	Particulars	Quarter ended on 31 st March, 2021	For the year ended on 31 st March, 2021	Corresponding 3 Months Ended on 31 st March, 2020
1	Total income from operations	1803.84	7427.68	1361.32
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	162.98	1599.06	185.89
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	162.98	1599.06	185.89
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	133.26	1206.62	138.84
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	142.05	1208.69	121.55
6	Equity Share Capital	627.16	627.16	627.16
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of Previous Year		5942.00	
8	Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations)			
	Basic :	2.12	19.24	2.27
	Diluted :	2.12	19.24	2.27

Notes:
1 The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Bombay Stock Exchange website (www.bseindia.com) The same is also available on the Company's website at www.vikramthermo.com
2 The result of the quarter ended on 31st March, 2021 were reviewed by the Audit Committee and approved by the Board of Director at its meeting held on 15-06-2021

BY ORDER OF THE BOARD OF DIRECTORS, FOR, VIKRAM THERMO (INDIA) LTD.
(D. K. PATEL)
[Managing Director]
(DIN 00044350)

Place: Ahmedabad
Date : 15/06/2021

PAT **Patels Airtemp (India) Limited**
ISO 9001:2015
Regd Office: 5th Floor, Kapana Complex, Nr. Memnagar Fire Station, Navrangpura, Ahmedabad - 380 009.
CIN No.: L29190GJ1992PLC017901, E-mail: share@patelsairtemp.com
Phone No.: +91-2764286634/35, Fax No.: +91-2764286301, Website: www.patelsairtemp.com

NOTICE TO EQUITY SHAREHOLDERS

Sub : Transfer of Equity Shares of Patels Airtemp (India) Limited ("the Company") to Investor Education and Protection Fund ("IEPF") Authority

This Notice is published pursuant to the provision of Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 as amended vide IEPF (Accounting, Audit, Transfer and Refund) Amendment Rules, 2017 ("the Rules") (as amended time to time).

The Rules, inter alia, contain provisions for transfer of all shares in respect of which dividend has not been paid or claimed by the shareholders for seven consecutive years or more, to Investor Education and Protection Fund (IEPF) Authority.

Adhering to the various requirements set out in the Rules, the Company has, during the Financial year 2020-21, already transferred to the IEPF Authority all Shares in respect of which dividend had remained unpaid or unclaimed for seven consecutive or more as on the due date of transfer is that 24th November, 2020. The Company has now communicated to the concerned shareholders individually whose shares are liable to be transferred to the Demat Account of Authority during the Financial year 2021-22 under the said rules for taking appropriate actions.

The full details of such shareholders and shares due for transfer to the IEPF Authority Demat Account are uploaded on the website of the company www.patelsairtemp.com. Shareholders are requested to refer the above website to verify the details of the shares liable to be transferred to the IEPF Authority.

Shareholders may note that both the unclaimed dividend and corresponding shares transferred to IEPF Authority can be claimed including all the benefits accruing on such shares, if any, can be claimed back from the IEPF Authority after following the procedure prescribed in the rules.

Concerned shareholders holding shares in physical form and whose shares are liable to be transferred to the IEPF Demat Account of Authority, may note that the Company would be issuing duplicate share certificate(s) in lieu of the original held by them for the purpose of transfer of the shares to the IEPF Demat Account of Authority as per the Rules and upon such issue, the original share certificate(s) which are registered in their name will stand automatically cancelled and be deemed non-negotiable and Company shall inform to Depository by Corporate Actions for transfer of shares against the demat shares that need to be transferred in favour of IEPF Authority. The shareholders may further note that the details uploaded by the Company on its website should be regarded and shall be deemed adequate notice in respect of issue of duplicate share certificate(s) and transfer the demat shares by the Company for the purpose of transfer of the shares to the IEPF Authority pursuant to the Rules.

In case the Company does not receive any communication from the concerned shareholders on or before 29th September, 2021, the Company shall with a view to adhering with the requirements of the Rules, dematerialise and transfer the shares to the IEPF Authority by way of Corporate Action as per the procedure set out in the Rules. No claim shall lie against the Company in respect of unclaimed dividend amount and shares transferred to IEPF Authority pursuant to the said Rules.

For further information the shareholder may contact the RTA of the Company i.e. Bigshare Services Private Limited, Unit: Patels Airtemp (India) Ltd., A-802 Samudra Complex, Near Klassic Gold, Girish cold Drink, Off. C. G. Road, Navrangpura Ahmedabad-380009, Gujarat. Ph. No. - 079-400 24135/079-400392570 or email to investor@bigshareonline.com / bssahd@bigshareonline.com or Company's factory (works) at 805-806-807-810 Rakanpur-382721, Via. Sola-Bhadaj Village, Ta. Kalol, Dist. Gandhinagar, Gujarat, Ph. No. 02764-286634/35 or email to share@patelsairtemp.com.

For Patels Airtemp (India) Limited
SD/-
(Nikhil M. Patel)
Sr. Company Secretary

Place: Rakanpur (Dist: Gandhinagar)
Date : 15th June, 2021

